

જા.નં.પગાર/એલ.ટી.સી./બ્લોક વર્ષ-૨૦૧૬-૧૮/રોકડ પેકેજ/૨૦૨૧/૫૧૦૬

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,
એ/૩, જિલ્લા સેવા સદન-૨,
અઠવાલાઈન્સ, સુરત,
તા.૨૫/૩/૨૦૨૧.

પ્રતિ,

આચાર્ય/આચાર્યાશ્રી,

સુરત જિલ્લાની બિન સરકારી અનુદાનિત માધ્યમિક
અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા.

વિષય:- બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક
કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં ખાસ રોકડ
પેકેજનો લાભ આપવા બાબત.

સંદર્ભ:- નાયબ શિક્ષણ નિયામકશ્રી, ૧૦+૨ શાખા, ગાંધીનગરના પત્રાંક:ઉમશ/ઉમા-૨/એલ.ટી.સી./
૨૦૨૧/૩૭૨૨-૩૭૫૭, તા.૨૪/૩/૨૦૨૧ અન્વયે.

ઉપરોક્ત વિષય અને સંદર્ભપત્ર અન્વયે જણાવવાનું કે, નાણાં વિભાગના તા.૨૨/૧૨/૨૦૨૦ના ઠરાવ
ક્રમાંક:મસભ-૧૦૨૦૧૩-૧૪૨૯૬૯-ચ થી રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત બ્લોક વર્ષ:
૨૦૧૬-૨૦૧૮ કે જે આપોઆપ એક વર્ષ લંબાયેલ છે. અને તેની મુદત તા.૩૧/૧૨/૨૦૨૦ ના રોજ પુર્ણ થાય છે.
તેમાં વધુ ત્રણ માસનો વધારો કરી તા.૩૧/૩/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે. તેમજ રજા પ્રવાસ રાહત/વતન
પ્રવાસ રાહત યોજના અંતર્ગત બ્લોક વર્ષ: ૨૦૧૬-૧૮નો લાભ લેવામાંથી વંચિત રહેલ કર્મચારીઓ અને હાલ સેવામાં
ચાલુ હોય તેવા કર્મચારીઓના કિસ્સામાં રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અનુસંધાનમાં ખરેખર મુસાફરી
કરવાના વિકલ્પે શરતોને આધિન ખાસ રોકડ પેકેજ યોજના જાહેર કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના સરખા
ક્રમાંકના તા.૫/૩/૨૦૨૧ના પત્રથી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના
કર્મચારીઓને નાણાં વિભાગના તા.૨૨/૧૨/૨૦૨૦ના ઠરાવની જોગવાઈ મુજબ બ્લોક વર્ષ: ૨૦૧૬-૧૮ની મુદત
તા.૩૧/૩/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે. તેનો લાભ મંજૂર કરવાનું જણાવેલ છે.

રાજ્યની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓને પ્રાપ્ત
રજા મળવાપાત્ર ન હોવાથી નાણાં વિભાગના તા.૨૨/૧૨/૨૦૨૦ના ઠરાવથી બ્લોક વર્ષ: ૨૦૧૬-૧૮ અંતર્ગત ખરેખર
મુસાફરીના વિકલ્પે જાહેર કરવામાં આવેલ ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. જ્યારે બિન શૈક્ષણિક
કર્મચારીઓને પ્રાપ્ત રજા મળવાપાત્ર હોવાથી, રજા પ્રવાસ રાહત યોજનાનો લાભ મંજૂર કરવા બાબતની તમામ શરતો
પરિપુર્ણ થતી હોય તેવા બિન શૈક્ષણિક કર્મચારીઓને નાણાં વિભાગના તા.૨૨/૧૨/૨૦૨૦ના ઠરાવની શરતો અને
જોગવાઈઓ મુજબ ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ આપવાનો રહેશે.

અત્રેના જિલ્લાની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારી ઓને ઉપરોક્ત ઠરાવનું ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ મળવાપાત્ર છે. તેથી આપની શાળાના બિન શૈક્ષણિક કર્મચારીઓ આ લાભ લેવા માંગતા હોય તેઓએ આવતી કાલે તા.૨૬/૩/૨૦૨૧ના રોજ સાંજે ૧૭-૦૦ કલાક(૦૫-૦૦) સુધીમાં અત્રેની કચેરીમાં મેન્યુઅલ બીલ બનાવી પગાર શાખામાં રૂબરૂમાં જમાં કરાવી દેવાનું રહેશે. અને તેવા જ મેન્યુઅલ બીલ ધ્યાને લેવામાં આવશે. ત્યારબાદ આવેલ બીલો સ્વીકારવામાં નહી આવે તેની ખાસ નોંધ લેશો.

સદર મેન્યુઅલ બીલમાં કર્મચારીની અરજી, કર્મચારીની સેવાપોથીમાં એલ.ટી.સી. બ્લોક વર્ષ-૨૦૧૬-૧૯ની રોકડ પેકેજની નોંધ કરી તેની નકલ, જી.એસ.ટી.વાળુ સાધન ખરીદીનું અસલ બીલ(તે પરત્વે ચુકવણું શક્યતા ડીજીટલ માધ્યમથી દ્વારા કરવામાં આવેલ હોય તેમજ જી.એસ.ટી. નંબર અને ચુકવેલ જીએસ.ટીની રકમ દર્શાવતું ચલણ મેળવવું), ગણતરી પત્રક, કુટુંબનું ડીકલેરેશન ફોર્મ, કુટુંબના સભ્યોની વિગત, પુત્ર-પુત્રી અભ્યાસ કરતી હોય તો તેનું બોનોફાઈડ સર્ટીફિકેટ, પત્ની નોકરી કરતી હોય તો તેની સંસ્થાનો એલ.ટી.સી. વર્ષ:૨૦૧૬-૧૯માં લાભ લીધેલ નથી તેવું લખાણ વિગેરે સામેલ કરવાનું રહેશે.


જિલ્લા શિક્ષણાધિકારી
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,
સુરત, જિલ્લો-સુરત.

ક્રમાંક: બમશ/૧૧૨૦૨૧/૧૧૩/૩
શિક્ષણ વિભાગ,
રાણિવાલાય, ગાંધીનગર.
તા.૨૪/૦૩/૨૦૨૧.


પ્રતિ,
નિયામકશ્રી
✓ શાળાઓની કચેરી,
બ્લોક નં. ૬/૧, ડૉ. જીવરાજ મહેતા ભવન,
ગાંધીનગર.

વિષય: રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના
કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં ખાસ રોકડ
પેકેજનો લાભ આપવા બાબત.

શ્રીમાન,


ઉપર્યુક્ત વિષયના સંદર્ભમાં જણાવવાનું કે, નાણા વિભાગના તા.૨૨/૧૨/૨૦૨૦ના કરાવ ક્રમાંક: મરાલ-૧૦૨૦૧૩-૧૪૨૯૬૯-ચ થી રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ કે જે આપોઆપ એક વર્ષ લંબાયેલ છે અને તેની મુદત તા.૩૧/૧૨/૨૦૨૦ના રોજ પૂર્ણ થાય છે તેમાં વધુ ૩(ત્રણ) માસનો વધારો કરી, તા.૩૧/૦૩/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે તેમજ રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯નો લાભ લેવામાંથી વંચીત રહેલ કર્મચારીઓ અને હાલ સેવામાં ચાલુ હોય તેવા કર્મચારીઓના કિસ્સામાં, રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અનુસંધાનમાં ખરેખર મુસાફરી કરવાના વિકલ્પે શરતોને આધીન ખાસ રોકડ પેકેજ યોજના અંતર્ગત કરવામાં આવેલ છે. વિભાગના સરખા ક્રમાંકના તા.૦૫/૦૩/૨૦૨૧ના પત્રથી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓને નાણા વિભાગના તા.૨૨/૧૨/૨૦૨૦ના કરાવની બેગવાઈ મુજબ બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ની મુદત તા.૩૧/૦૩/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે તેનો લાભ મંજૂર કરવાનું જણાવેલ છે.

રાજ્યની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓને પ્રાપ્ત રજા મળવાપાત્ર ન હોવાથી નાણા વિભાગના તા.૨૨/૧૨/૨૦૨૦ના કરાવથી બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ અંતર્ગત ખરેખર મુસાફરીના વિકલ્પે ખરેખર કરવામાં આવેલ ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. જ્યારે બિન શૈક્ષણિક કર્મચારીઓને પ્રાપ્ત રજા મળવાપાત્ર હોવાથી, રજા પ્રવાસ રાહત યોજનાનો લાભ મંજૂર કરવા બાબતની તમામ શરતો પરિપૂર્ણ થતી હોય તેવા બિન શૈક્ષણિક કર્મચારીઓને નાણા વિભાગના તા.૨૨/૧૨/૨૦૨૦ના કરાવની શરતો અને બેગવાઈઓ મુજબ ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ આપવાનો રહેશે.

આપનો વિશ્વાસુ

(એસ.વી.ગઢવી)
સેક્શન અધિકારી
શિક્ષણ વિભાગ

ક્રમાંક:- ઉમશ/ઉમા-૦૨/એલ.ટી.સી./૨૦૨૧/૩૭૨૨-૩૭૫૭
કમિશનર શાળાઓની કચેરી,
બ્લોક નં. ૦૬, ડૉ. જીવરાજ મહેતા ભવન,
ગુ.રા., ગાંધીનગર. તા. /૦૩/૨૦૨૧

૨/- નકલ રવાના જાણ તથા અમલ સારું


નાયબ શિક્ષણ નિયામક
૧૦+૨ શાખા, ગાંધીનગર

પ્રતિ,

વિદ્યા શિક્ષણાધિકારીશ્રી, તમામ. (શિ.વિ.ના પત્ર ક.બમશ/૧૧૨૦૨૧/૧૧૩/૩ તા.૨૪/૦૩/૨૦૨૧ની અમલવારી સારું)

અવિનય નકલ રવાના:-

- નાયબ શિક્ષણ નિયામકશ્રી, માધ્યમિક, અત્રેની કચેરી
- નાયબ શિક્ષણ નિયામકશ્રી, મહેકમ, અત્રેની કચેરી

રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ
રાહત યોજનાની અવેજીમાં ખાસ
રોકડ પેકેજ જાહેર કરવા અને
બ્લોક વર્ષ ૨૦૧૬-૧૮ ની
મુદતમાં વધારો કરવા બાબત

ગુજરાત સરકાર
નાણા વિભાગ

ઠરાવ ક્રમાંક: મસભ-૧૦૨૦૧૩-૧૪૨૯૬૯-ચ
સચિવાલય, ગાંધીનગર.
તારીખ: ૨૨/૧૨/૨૦૨૦

- વંચાણે લીધા: (૧) નાણા વિભાગના ઠરાવ ક. મસભ/૧૦૨૦૧૩/૧૪૨૯૬૯/ચ,
તા. ૨૮/૮/૨૦૧૫
(૨) નાણા વિભાગના ઠરાવ ક. મસભ/૧૦૨૦૧૩/૧૪૨૯૬૯/ચ,
તા. ૨૨/૩/૨૦૧૬
(૩) ભારત સરકાર, નાણા મંત્રાલયનું ઓફીસ મેમોરેન્ડમ નં. એફ નં.
૧૨(૨)/૨૦૨૦-છા(એ) તા. ૧૨/૧૦/૨૦૨૦

// ઠરાવ //

રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના નાણા વિભાગના તા. ૧૫/૧૦/૧૯૬૬ ના ઠરાવથી અમલમાં મુકવામાં આવેલ છે. પ્રસ્તુત યોજના અંતર્ગત વખતોવખત થયેલ સુધારાનું વહીવટી અમલીકરણ સરળ બને તે હેતુસર વંચાણમાં લીધેલ ક્રમ (૧) અને ક્રમ (૨) ના ઠરાવથી સંકલીત સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે.

હાલમાં કોવિડ-૧૯ મહામારી અંતર્ગત સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે ટ્રાન્સપોર્ટેશન અને હોસ્પિટાલીટી ક્ષેત્રમાં મુશ્કેલી પડવાના કારણે, રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત રાજ્ય સરકારના અમુક કર્મચારીઓ ગત બ્લોક વર્ષ ૨૦૧૬-૧૮ કે જે આપોઆપ એક વર્ષ લંબાયેલ છે અને તેની મુદત તા. ૩૧/૧૨/૨૦૨૦ ના રોજ પૂર્ણ થાય છે, તેનો લાભ લઈ શકેલ નથી. સદરહુ મુદતમાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

વધુમાં, હાલ કોરોના મહામારી અંતર્ગત લોકડાઉનના કારણે વેપાર જગતમાં તંગી પ્રવર્તે છે. તે જોતાં લોકોની ખરીદ શક્તિ વધે અને તે મુજબ રાજ્યની અર્થવ્યવસ્થાને વધુ વેગ મળે તે હેતુને ધ્યાને રાખી, રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજ યોજના જાહેર કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ઉપર જણાવેલ બન્ને બાબતો પરત્વે પુખ્ત વિચારણાના અંતે ઉપર વંચાણમાં લેવામાં આવેલ ક્રમ(૧) અને (૨) ના ઠરાવની જોગવાઈઓને આધીન નીચે મુજબ આથી ઠરાવવામાં આવે છે.

રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત ગત બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ કે જે આપોઆપ એક વર્ષ લંબાયેલ છે અને તેની મુદત તા. ૩૧/૧૨/૨૦૨૦ ના રોજ પૂર્ણ થાય છે તેમાં વધુ ૩ (ત્રણ) માસનો વધારો કરી, તા. ૩૧/૩/૨૦૨૧ સુધી લંબાવવામાં આવે છે.

રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત ગત બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ નો લાભ લેવામાંથી વંચીત રહેલ કર્મચારીઓ અને હાલમાં સેવામાં ચાલુ હોય તેવા કર્મચારીઓના કિસ્સામાં, રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અનુસંધાનમાં ખરેખર મુસાફરી કરવાના વિકલ્પે નીચે જણાવેલ શરતોને આધીન ખાસ રોકડ પેકેજ યોજના જાહેર કરવામાં આવે છે.

૧. જે કર્મચારીઓ દ્વારા બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ નો લાભ ભોગવી લેવામાં આવેલ છે તેઓને આ ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.
૨. આ યોજના બ્લોક વર્ષ ૨૦૨૦-૨૩ માટે લાગુ પડશે નહીં.
૩. ખાસ રોકડ પેકેજ યોજના અંતર્ગત રજા પ્રવાસ રાહત પેશગી મળવાપાત્ર થશે નહીં.
૪. ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ લેવા ઇચ્છુક કર્મચારીઓના કિસ્સામાં, કર્મચારી દ્વારા રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત નિયમોનુસાર મળવાપાત્ર થતી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતરની રકમ જેટલો કે તેથી વધુ ખર્ચ કરવામાં આવે તો જ, તે રજાનું રોકડમાં રૂપાંતરની મળવાપાત્ર થતી રકમ ગણતરીમાં લેવાની રહેશે. સદરહુ રજાઓને એલટીસી અંતર્ગત રજાનું રોકડમાં રૂપાંતર કરવા બાબતમાં મળવાપાત્ર રજાઓમાં ગણતરીમાં લેવાની રહેશે.
૫. આ યોજના અંતર્ગત સુચિત રજા પ્રવાસ રાહતનું ભાડું નીચે જણાવ્યા મુજબ મંજૂર કરવાનું રહેશે.

અધિકારી/કર્મચારીની કક્ષા	પ્રત્યેક કર્મચારીના કિસ્સામાં મુસાફરી અંગે સુચિત ભાડું (સંપૂર્ણ ભાડું)
છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. ૭૬૦૦/- ગ્રેડ પે કે તેથી વધુ ગ્રેડ પે મુજબનો પગાર ધરાવતા	રૂ. ૨૦,૦૦૦/-
છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. ૭૬૦૦/- ગ્રેડ પે કરતા ઓછો ગ્રેડ પે મુજબનો પગાર ધરાવતા	રૂ. ૬,૦૦૦/-

૬. ઉપર જણાવેલ ભાડાની સુચિત રકમ કરતા કર્મચારી દ્વારા ૩ (ત્રણ) ગણો ખર્ચ કરવામાં આવે તો, સુચિત ભાડાની રકમ મળવાપાત્ર બનશે.

૭. રજાનું રોકડમાં રૂપાંતર અને સૂચિત ભાડાની રકમની પાત્રતા માટે, કર્મચારી દ્વારા જીએસટી રજીસ્ટર્ડ વેપારી/સેવા પુરી પાડનાર પાસેથી, ૧૨% થી ઓછો જીએસટી દર ન હોય તેવી કોઈ વસ્તુ ખરીદ કરવામાં/સેવા મેળવવામાં આવેલ હોય અને તે પરત્વેનું ચુકવણું શક્યતઃ ડિજિટલ માધ્યમ દ્વારા કરવામાં આવેલ હોય તેમજ જીએસટી નંબર અને ચુકવેલ જીએસટીની રકમ દર્શાવતું ચલણ મેળવેલ હોય તે ધ્યાને લઈ, (૧) રજાનું રોકડમાં રૂપાંતર જેટલી રકમ અને (૨) સૂચિત ભાડાથી ત્રણ ગણી રકમનો ખર્ચ કરવાનો રહેશે.

૮. કર્મચારીને મળવાપાત્ર રકમનું ચુકવણું સદરહુ પેકેજની કુલ રકમ (એલટીસી માટે મળવાપાત્ર રજાનું રોકડમાં રૂપાંતર અને સૂચિત ભાડું) અથવા આ સાથે સામેલ પરિશિષ્ટ - A મુજબના ઉદાહરણમાં દર્શાવ્યા મુજબના ખર્ચની મર્યાદામાં મળવાપાત્ર થશે.

જે કર્મચારીનાં કિસ્સામાં રજાનું રોકડમાં રૂપાંતરનો લાભ મેળવ્યા સિવાય ખાસ રોકડ પેકેજનો લાભ મળવાપાત્ર બનતો હોય, તે કિસ્સામાં આ સાથે સામેલ પરિશિષ્ટ - B મુજબની મર્યાદામાં રકમ મળવાપાત્ર થશે.

૯. સદરહુ યોજના અંતર્ગત પરિશિષ્ટ-A મુજબના ઉદાહરણમાં દર્શાવ્યા મુજબના જે તે કર્મચારીને મળવાપાત્ર રજાનું રોકડમાં રૂપાંતરની રકમ (A) હોય, તેમજ તેમને મળવાપાત્ર સૂચિત ભાડાની રકમ (B) ધ્યાને લેતા, જે તે કર્મચારી દ્વારા જો રજાનું રોકડમાં રૂપાંતરની રકમ (A) અને મળવાપાત્ર સૂચિત ભાડાની ત્રણ ગણી રકમ (3XB) જેટલો ખર્ચ કરવામાં આવે તો સદરહુ પેકેજ યોજના અંતર્ગત મહત્તમ રકમ એટલે કે રજાનું રોકડમાં રૂપાંતરની રકમ (A) અને મળવાપાત્ર સૂચિત ભાડાની રકમ (B) જેટલી રકમ મળવાપાત્ર થશે.

૧૦. જે કિસ્સામાં રજાનું રોકડમાં રૂપાંતરની રકમ (A) અને મળવાપાત્ર સૂચિત ભાડાની ત્રણ ગણી રકમ (3XB) કરતાં ઓછો ખર્ચ કરવામાં આવે તે કિસ્સામાં આ સાથે સામેલ ઉદાહરણ (પરિશિષ્ટ-A) મુજબ પ્રોપોર્શન ધોરણે રકમ મળવાપાત્ર રહેશે.

૧૧. સદરહુ પેકેજ યોજનાનો લાભ તા. ૩૧/૩/૨૦૨૧ સુધીમાં લેવાનો રહેશે અને આ બાબત પરત્વેના દાવાઓ શક્યતઃ તા. ૩૧/૩/૨૦૨૧ સુધીમાં સરભર કરવામાં આવે તે જોવાનું રહેશે.

૧૨. પ્રવર્તમાન નિયમોનુસાર રજાનું રોકડમાં રૂપાંતરના કિસ્સામાં ટીડીએસ લાગુ પડે છે. સદરહુ પેકેજ યોજના અંતર્ગત સૂચિત ખરેખર કરેલ મુસાફરીના બદલે એલટીસી ભાડું સરભર કરવાનું નિયત કરવામાં આવેલ હોવાની બાબત ધ્યાને લેતાં, સદરહુ રજાનું રોકડમાં રૂપાંતરની રકમ આવકવેરાના હેતુ માટે ગણતરીમાં લેવાની રહેશે નહીં તેમજ સૂચિત એલટીસી ભાડાને સરભર કરતા સમયે ટીડીએસની કપાત કરવાની રહેશે નહીં.

૧૩. સદરહુ પેકેજ યોજનાનો લાભ લેવા માટે કર્મચારીએ ફરજિયાતપણે રજાનું રોકડમાં રૂપાંતર અને એલટીસી ભાડું બન્નેનો લાભ લેવાનો રહેશે અને તો જ આ પેકેજનો લાભ મળવાપાત્ર થશે.

૧૪. સદરહુ પેકેજ યોજનાના અમલીકરણના અનુસંધાનમાં લાગુ પડતી વધુ સ્પષ્ટતાઓ આ સાથે સામેલ પત્રક મુજબ ધ્યાને લેવાની રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,


(મહેશ પી. ધોળકિયા)
સેક્શન અધિકારી
નાણા વિભાગ

નકલ રવાના પ્રતિ :-

- માન. રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર
- માન. મુખ્ય મંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર
- માન. મંત્રીશ્રીઓ/રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર
- માન. વિરોધપક્ષના નેતાશ્રીના અંગત સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર.
- સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર.
- રજીસ્ટ્રારશ્રી, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ.
- રજીસ્ટ્રારશ્રી, ગુજરાત લોકાયુક્ત કચેરી, લોકાયુક્ત ભવન, ગાંધીનગર.
- સચિવશ્રી, ગુજરાત રાજ્ય તકેદારી આયોગ, ગાંધીનગર.
- સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર.
- અધ્યક્ષશ્રી, ગુજરાત મુલ્કી સેવા ટ્રીબ્યુનલ, ગાંધીનગર.
- સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.
- સચિવાલયના તમામ વિભાગો/સર્વે ખાતાના વડાઓ
- એકાઉન્ટન્ટ જનરલ ઓડિટ-૧, ગુજરાત, બહુમાળી ભવન, લાલ દરવાજા, અમદાવાદ.
- એકાઉન્ટન્ટ જનરલશ્રી(એ.એન્ડ ઇ.), ગુજરાત, પો.બો. નં. ૨૨૦, રાજકોટ.
- એકાઉન્ટન્ટ જનરલશ્રી (એ એન્ડ ઇ) ગુજરાત, અમદાવાદ.
- પગાર અને હિસાબી અધિકારીશ્રી, ગાંધીનગર/અમદાવાદ.
- સર્વે જીલ્લા તિજોરી અધિકારીશ્રીઓ/પેટા તિજોરી અધિકારીશ્રીઓ.
- સ્થાનિક ભંડોળ હિસાબ, ડી. એ. ટી. ગાંધીનગર /સર્વે સહાયક નિરિક્ષકશ્રીઓ.
- નિવાસી ઓડીટ અધિકારીશ્રી, અમદાવાદ/ગાંધીનગર.
- નિયામકશ્રી, હિસાબ અને તિજોરીની કચેરી, લેખાનુભવન, ગાંધીનગર.
- નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી, લેખાનુભવન, ગાંધીનગર.
- તમામ નિગમ/બોર્ડ/યુનિવર્સિટીઓ/રાજ્ય સરકારના તમામ જાહેર સાહસો.
- સીસ્ટમ મેનેજરશ્રી, નાણા વિભાગ..... વેબસાઇટ ઉપર મુકવા સારૂ.
- સિલેક્ટ ફાઇલ
- પત્ર દ્વારા

ખાસ રોકડ પેકેજ યોજના અંતર્ગત સંભવિત પ્રશ્નો અને જવાબો

ક્રમ	પ્રશ્ન	જવાબ
૧	સદરહું ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ લેવા માટે જે-તે કર્મચારીએ રજા લેવી અથવા ખરેખર મુસાફરી કરવી આવશ્યક છે?	સદરહું યોજના રજા પ્રવાસ રાહત યોજનાની ઝલેજીમાં હોઇ, જે-તે કર્મચારીએ રજા લેવાની કે ખરેખર મુસાફરી કરવાની આવશ્યકતા નથી.
૨	સદરહું યોજના માટે ઉપયોગમાં લેવામાં આવનાર જે-તે ઓલટીસી બ્લોકનો આંશિક ઉપયોગ જે-તે કર્મચારી અથવા તેના કુટુંબનાં સભ્યો દ્વારા કરવામાં આવેલ હોય તેમને સદરહું યોજનાનો લાભ મળવાપાત્ર છે? કેટલી મર્યાદામાં?	હા. બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ દરમિયાન વણવપરાયેલ ઓલટીસી ભાડાની મર્યાદામાં નાણા વિભાગનાં તા.૨૮/૦૮/૨૦૧૫નાં ઠરાવની જોગવાઈ મુજબ પ્રોરાટા ધોરણે મળવાપાત્ર થશે.
૩	જો કોઇ કર્મચારી રજા પ્રવાસ રાહત યોજનાનાં હેતુ માટે મળવાપાત્ર રજાનું રોકડમાં રૂપાંતરની મહત્તમ મર્યાદા વટાવી ચુકેલ હોય તો તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર છે?	હા. પરિશિષ્ટ-B નાં ઉદાહરણ મુજબ મળવાપાત્ર થશે.
૪	વસ્તુ અથવા સેવાની ખરીદીનાં અનુસંધાને એક જ બીલ રજુ કરવાનું રહેશે કે એકથી વધારે બીલો પણ રજુ કરી શકાય?	એક થી વધારે બીલો પણ રજુ કરી શકાય છે. વસ્તુ અથવા સેવાની ખરીદી આ ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખ થી તા.૩૧/૦૩/૨૦૨૧ સુધીમાં થયેલ હોવી જોઇએ. ૧૨% થી વધારે જીએસટી દર ધરાવતી વસ્તુ અથવા સેવાની ખરીદી થયેલ હોવી જોઇએ અને તેનાં માટેનું ચુકવણું શક્યતઃ ડિજિટલ માધ્યમથી થયેલ હોવું જોઇએ.
૫	આ યોજનાનો લાભ લેવા માટેની અરજી કરવા અંગે કોઇ સૂચિત નમૂનો છે?	કોઇ જ સૂચિત નમૂનો નથી. સદરહું યોજનાનો લાભ લેવા અંગેની સાદી અરજી સક્ષમ અધિકારી સમક્ષ રજુ કરવાની રહેશે.
૬	જો કોઇ કર્મચારી જે-તે વસ્તુ/સેવા, બીલ/ઇનવોઇસ મુજબ	જીએસટીની વિગતો ધરાવતાં ઇનવોઇસનાં આધારે સદરહું યોજના

તા ૩૧/૦૩/૨૦૨૧નાં રોજ અથવા તે પહેલાં ખરીદી કરે છે પરંતુ જે તે વસ્તુ/સેવા એપ્રિલ ૨૦૨૧ દરમિયાન મેળવે તેવા કિસ્સામાં?	અંતર્ગત ખર્ચની રકમ મળવાપાત્ર છે. આથી, અંતિમ સમયે વહીવટી પ્રશ્નો ઉઠાવે નહિ તે બાબત ધ્યાને લેતાં, સરકારી યોજનાનો લાભ લેવા માટેનાં દાવાઓ શક્યતઃ તા ૩૧/૦૩/૨૦૨૧ પહેલાં સરભર કરવાની તકેદારી રાખવી હિતાવહ છે.
૭ ડિજિટલ માધ્યમથી ચુકવણું કરવા જે તે કર્મચારી દ્વારા તેનાં પતિ/પત્નિ અથવા કુટુંબનાં અન્ય સભ્યોનાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકાય?	સરકારી યોજના અંતર્ગત ખર્ચની રકમ મેળવવા માટે રજુ કરવામાં આવનાર ઇનવોઇસ જે-તે કર્મચારીનાં નામે હોવું જરૂરી છે.
૮ લેવડ-દેવડ(ટ્રાન્ઝેક્શન) ની કોઈ સંખ્યા મર્યાદા છે?	વહીવટી અનુકૂળતા જળવાય તે હેતુને ધ્યાને લેતાં શક્યતઃ ઓછી સંખ્યામાં લેવડ-દેવડ કરવી.
૯ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી કરી શકાય?	જરૂરી ઇનવોઇસ/વિગતો આપવામાં આવે તેવા કિસ્સાઓ માટે, ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી કરી શકાય.
૧૦ પતિ-પત્નિ બન્ને સરકારી કર્મચારીઓ હોય. જો એક કર્મચારી દ્વારા પોતાના અને પોતાના પતિ/પત્નિ માટે, ખાસ રોકડ પેકેજનો લાભ, રજાનું રોકડમાં રૂપાંતર સહિત મેળવેલ હોય તો તેવા કિસ્સામાં તેના પત્નિ/પતિને રજાનું રોકડમાં રૂપાંતર મળી શકે?	હા.
૧૧ લોન/ઇએમઆઇ પદ્ધતિ મુજબ ખરીદ કરવામાં આવેલ હોય તેવી વસ્તુ / સેવાનો સમાવેશ આ યોજના અંતર્ગત થાય છે?	લોન/ઇએમઆઇ પદ્ધતિ મુજબ ૧૨%થી ઓછો નહિ તેવી કોઇપણ વસ્તુ/સેવાની ખરીદી જો આ ઠરાવ બહાર પાડ્યા તારીખ કે ત્યારબાદ કરવામાં આવેલ હોય અને તેનું બીલ રજુ કરવામાં આવે તો આ યોજનાનો લાભ મળવાપાત્ર બનશે.
૧૨ ચેક/ડીડી/બેન્કર્સ ચેક/એનઇએફટી/આરટીજીએસ વડે ચુકવણું કરી શકાય?	હા

૧૩	પાંચ વર્ષથી નાની વયનાં બાળકોનાં કિસ્સામાં રેલ્વે ભાડું ચુકવવાનું રહેતું નથી. તો આવા બાળકો આ યોજના હેઠળ આશ્રિત તરીકે ગણતરીમાં લેવાનાં રહે છે?	હા. જો રજા પ્રવાસ રાહત યોજના નિયમો મુજબ જે-તે બાળક આશ્રિત તરીકે ગણવામાં આવતો હોય તો.
૧૪	શું સ્વાયત્ત સંસ્થાઓને આ યોજના લાગુ પડે છે?	આ ઠરાવ બહાર પાડ્યા તારીખ પહેલાથી જો કોઈ સ્વાયત્ત સંસ્થા દ્વારા રાજ્ય સરકારનાં નિયમોનુસાર રજા પ્રવાસ રાહત યોજના લાગુ કરવામાં આવેલ હોય તો જે-તે સ્વાયત્ત સંસ્થા આ યોજના અપનાવવા બાબતમાં વિચારણા કરી શકે છે.
૧૫	આ ઠરાવ બહાર પાડ્યા તારીખ કે ત્યારબાદ ખરીદ કરવામાં આવેલ હોય અને આ ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ લેવા માટેનો વિકલ્પ આપવામાં આવેલ ન હોય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર છે?	આ ઠરાવ બહાર પાડ્યા તારીખ થી તા.૩૧/૦૩/૨૦૨૧ દરમિયાન કરવામાં આવેલ ખરીદી માટે સદરહું યોજનાનો લાભ મળવાપાત્ર છે.
૧૬	જે-તે કર્મચારી ૧૦ દિવસથી ઓછી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર મેળવી શકે છે?	રજા પ્રવાસ રાહત યોજનાનાં નિયમોની જોગવાઈઓ મુજબ પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર મેળવી શકાય.
૧૭	પહેલા થી અસ્તિત્વમાં હોય તેવી વીમા યોજનાઓનાં પ્રિમીયમ માટેનાં ચુકવણાનો સમાવેશ આ યોજના અંતર્ગત થઈ શકે?	સદરહું યોજનાનો લાભ ૧૨% થી ઓછો નહિ તેવી વસ્તુ/સેવાની ખરીદી આ ઠરાવ બહાર પાડ્યા તારીખથી તા.૩૧/૦૩/૨૦૨૧ દરમિયાન કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં જ મળવાપાત્ર છે. પહેલા થી અસ્તિત્વમાં હોય તેવી વીમા યોજનાઓનાં પ્રિમીયમનો સમાવેશ આ યોજના હેઠળ થતો નથી. તેમ છતાં, આ ઠરાવ બહાર પાડ્યા તારીખથી તા.૩૧/૦૩/૨૦૨૧ દરમિયાન લેવામાં આવેલ ૧૨% થી ઓછો જીએસટી દર ન હોય તેવી વીમા પોલીસીનાં પ્રિમીયમનો ખર્ચ આ યોજના હેઠળ મળવાપાત્ર થશે.

૧૮	જે-તે કર્મચારી દ્વારા ખરીદ કરવામાં આવેલ વસ્તુ/સેવા પૈકીનાં ઓરીજનલ બીલ ઉપાડ અને વહેંચણી અધિકારીને રજુ કરવા જરૂરી છે?	ના. જે-તે બીલ અંગેની સ્વપ્રમાણીત નકલ રજુ કરવાની રહેશે. પરંતુ, જરૂર જણાયે ઓરીજનલ બીલ રજુ કરવાના રહેશે.
૧૯	સદરહું યોજના હેઠળ બીલ/વાઉચર તા.૩૧/૦૩/૨૦૨૧ પહેલા રજુ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. તા.૩૧/૦૩/૨૦૨૧ કે તે પહેલા વચ-નિવૃત્ત થતાં કર્મચારીઓનાં કિસ્સામાં પણ અંતિમ તારીખ આ જ રહેશે?	જે-તે કર્મચારી દ્વારા તેઓ વચનિવૃત્ત થાય તે તારીખે અથવા એ પહેલા વાઉચર/બીલો રજુ કરવાનાં રહેશે.

પરિશિષ્ટ-A

ઉદાહરણ:-

જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂ. ૫૦,૦૦૦/- છે અને તેના કુટુંબના ૪ સભ્યો હોય તો,

- કર્મચારીનો મૂળ પગાર = રૂ. ૫૦,૦૦૦/-
- મોઘવારી ભથ્થું = ૧૬૪ % (છઠ્ઠા પગાર પંચ મુજબ)
- રજાનું રોકડમાં રૂપાંતર = $\left[\frac{૫૦૦૦૦ + (૫૦૦૦૦ \times ૧.૬૪)}{૩૦} \right] \times ૧૦ = રૂ. ૪૪,૦૦૦/- (A)$
- સુચિત ભાડાની રકમ: રૂ. ૨૦,૦૦૦/- (છઠ્ઠા પગાર પંચ મુજબ ગ્રેડ પે-૭૬૦૦ કે તેથી વધુ)
- કુટુંબના ૪ સભ્યોની ગણતરી ધ્યાને લેતાં,
- ભાડાની સુચિત રકમ : $૨૦,૦૦૦ \times ૪ = રૂ. ૮૦,૦૦૦/- (B)$
- મળવાપાત્ર મહત્તમ રકમ = રૂ. ૪૪,૦૦૦/- (A) + રૂ. ૮૦,૦૦૦/- (B) = રૂ. ૧,૨૪,૦૦૦/-
- યોજના અંતર્ગત રોકડનો સંપૂર્ણ લાભ લેવા માટે ખર્ચ કરવાની થતી ન્યુનતમ રકમ
 $= A + (3 \times B)$

$$= ૪૪,૦૦૦ + ૨,૪૦,૦૦૦ = રૂ. ૨,૮૪,૦૦૦/-$$

$$(૧). \text{ રજાનું રોકડમાં રૂપાંતરની ટકાવારી } = \left[\frac{૪૪,૦૦૦ \times ૧૦૦}{૨,૮૪,૦૦૦} \right] = ૧૫.૪૯ \%$$

$$(૨). \text{ સુચિત ભાડાની ટકાવારી } = \left[\frac{૮૦,૦૦૦ \times ૧૦૦}{૨,૮૪,૦૦૦} \right] = ૨૮.૧૬ \%$$

- આમ, ઉપરોક્ત ઉદાહરણ મુજબ જો કોઈ કર્મચારી રૂ. ૨,૮૪,૦૦૦/- કે તેથી વધુ રકમનો ખર્ચ કરે તો તેને મહત્તમ રૂ. ૨,૮૪,૦૦૦/- નાં ૪૩.૬૫% રકમ એટલે કે, કુલ રૂ. ૧,૨૪,૦૦૦/- પરત મળવાપાત્ર થશે.

વધુમાં, જો કોઈ કર્મચારી દ્વારા આ યોજના અંતર્ગત રોકડનો સંપૂર્ણ લાભ લેવા માટે ખર્ચ કરવાની થતી ન્યુનતમ રકમ કરતા ઓછો ખર્ચ કરવામાં આવે તેવા કિસ્સામાં, ઉપર જણાવ્યા મુજબની ગણતરી વ્યક્તિગત કિસ્સામાં કર્યા મુજબ, રજાનાં રોકડમાં રૂપાંતર પેટે મળવાપાત્ર થતી રકમ અને ભાડાની રકમ પેટે મળવાપાત્ર થતી રકમ, આ યોજના અંતર્ગત મળવાપાત્ર થતી મહત્તમ રકમ (A+B) ની મર્યાદામાં મળવાપાત્ર થશે.

પરિશિષ્ટ- B

ઉદાહરણ:-

જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂ. ૫૦,૦૦૦/- છે અને તેના કુટુંબના ૪ સભ્યો હોય તો,

- કર્મચારીનો મૂળ પગાર = રૂ. ૫૦,૦૦૦/-
- સુચિત ભાડાની રકમ: રૂ. ૨૦,૦૦૦/- (છઠ્ઠા પગાર પંચ મુજબ ગ્રેડ પે-૭૬૦૦ કે તેથી વધુ)
- કુટુંબના ૪ સભ્યોની ગણતરી ધ્યાને લેતાં
ભાડાની સુચિત રકમ : $૨૦,૦૦૦ \times ૪ = રૂ. ૮૦,૦૦૦/-$
- સંપૂર્ણ રોકડનો લાભ લેવા માટે કરવાના થતા ખર્ચની રકમ = $૮૦,૦૦૦ \times ૩ = રૂ. ૨,૪૦,૦૦૦/-$
- મળવાપાત્ર મહત્તમ રકમ = રૂ. ૮૦,૦૦૦/-
- મળવાપાત્ર રોકડ લાભની રકમ =

કર્મચારી દ્વારા કરવામાં આવેલ ખર્ચ X મળવાપાત્ર સૂચિત ભાડું

સંપૂર્ણ રોકડનો લાભ લેવા માટે કરવાના થતા ખર્ચની રકમ

- જો, કર્મચારી દ્વારા રૂ. ૨,૪૦,૦૦૦/- કે તેથી વધુનો ખર્ચ કરવામાં આવે તેવા કિસ્સામાં,
મળવાપાત્ર રોકડ લાભની રકમ = $\frac{૨,૪૦,૦૦૦ \times ૮૦,૦૦૦}{૨,૪૦,૦૦૦} = ૮૦,૦૦૦/-$

- જો, કર્મચારી દ્વારા રૂ. ૧,૨૦,૦૦૦/- (સંપૂર્ણ રોકડનો લાભ લેવા માટે કરવાના થતા ખર્ચની રકમ કરતા ઓછી રકમ)નો ખર્ચ કરવામાં આવે તેવા કિસ્સામાં,
મળવાપાત્ર રોકડ લાભની રકમ = $\frac{૧,૨૦,૦૦૦ \times ૮૦,૦૦૦}{૨,૪૦,૦૦૦} = ૪૦,૦૦૦/-$